

**Corporate Relations Department  
BSE Limited  
Phiroze Jeejeebhoy Towers  
Dalal Street,  
Mumbai - 400 001.**

Ref: RCL:KPS:BSE:NEWS-AFR-MAR/23:

Date: 30th May, 2023

Dear Sir,


**Sub: News Paper Cuttings of Published Extract of Audited Financial Results for the Quarter and Year ended 31<sup>st</sup> March, 2023.  
Scrip Code: 500360**

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, please find enclosed herewith News Paper Cuttings of Extract of Audited Financial Results for the Quarter and Year ended 31st March, 2023 published in Business Standard – Ahmedabad edition and Loksatta - Jansatta - Vadodara edition.


You are requested to take a note of the same.

Thanking you,

Yours faithfully,  
**For RAPICUT CARBIDES LIMITED**



**Komal Soni  
(Company Secretary & Compliance Officer)**



Encl: As above.

bm-267-cor-

## **Rapicut Carbides Limited**

**Regd. Office & Works :** 119, GIDC Industrial Area, On National Highway BOM-AHM, Ankleshwar - 393 002. Gujarat (India)  
Tel/Landline : (+91) 7573022016, 7622002203 E-Mail : info@rapicutcarbides.com | sales@rapicutcarbides.com  
www.rapicutcarbides.com | www.rapicutcarbides.in

**CIN : L28910GJ1977PLC002998**



MANGALAM SEEDS LIMITED					
Registered Office : 202, Sampada Complex, B/h. Tulsi Complex, Mithakhali Six Roads, Navrangpura, Ahmedabad - 380 009. CIN : L01112GJ2011PLC067128 Phone : 079-26447302 Email : cs@mangalamseeds.com Web : www.mangalamseeds.com					
STATEMENT OF AUDITED CONSOLIDATED RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2023					
(Amount in Lakh Rupees)					
Particulars	Consolidated				
	Quarter Ended			Year Ended	
	31.03.2023	31.12.2022	31.03.2022	31.03.2023	31.03.2022
	Audited	Unaudited	Audited	Audited	Audited
Total Revenue from Operations	1579.50	2105.30	643.71	6536.55	4084.83
Profit before exceptional and extraordinary items and tax	521.20	393.99	108.90	1334.61	616.99
Profit before Tax	521.20	393.99	108.90	1334.61	616.99
Profit for the period	439.82	320.24	101.61	1107.11	516.74
Total Comprehensive Income	453.15	318.31	106.05	1122.59	525.10
Paid up Equity Share Capital (Equity Shares of Rs. 10/- each)	1098.02	1098.02	1098.02	1098.02	1098.02
Other Equity excluding Revaluation Reserve	-	-	-	4564.61	3442.03
Earning Per Share Basic :	4.07	2.85	0.93	10.08	4.71
Diluted :	4.07	2.85	0.93	10.08	4.71
The above audited consolidated financial results of the Company have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on May 29, 2023.					
Additional Information related to Standalone Financial Results : (Amount in Lakh Rupees)					
Particulars	Standalone				
	Quarter Ended			Year Ended	
	31.03.2023	31.12.2022	31.03.2022	31.03.2023	31.03.2022
	Audited	Unaudited	Audited	Audited	Audited
Total Revenue from Operations	1579.92	2106.30	638.54	6519.02	4014.53
Profit before exceptional and extraordinary items and tax	524.24	394.52	107.48	1334.39	612.70
Profit before Tax	524.24	394.52	107.48	1334.39	612.70
Profit for the period	439.07	322.03	99.95	1107.53	513.01
Total Comprehensive Income	452.40	320.11	104.40	1123.00	521.37
Paid up Equity Share Capital (Equity Shares of Rs. 10/- each)	1098.02	1098.02	1098.02	1098.02	1098.02
Reserves	-	-	-	4555.55	3432.55
Earning Per Share Basic :	4.07	2.87	0.91	10.09	4.67
Diluted :	4.07	2.87	0.91	10.09	4.67
Note : The above is an extract of the detailed format of unaudited Consolidated Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited Quarterly Financial Results (Consolidated and Standalone) are available on Company's Website : <a href="http://www.mangalamseeds.com">www.mangalamseeds.com</a> and also on the website of the stock exchange i.e. BSE Limited - <a href="http://www.bseindia.com">www.bseindia.com</a>					
Place : Ahmedabad For Mangalam Seeds Limited Date : 30.05.2023 Sd/- Pravin Kumar Patel (Managing Director)					

Navyug College Branch, ground Floor, Raviraj Apartment, Near Navyug College, Rander Road, Surat-395 009. Ph: 261-2787306, 2786307. E-mail: ransur@bankofbaroda.com

**POSSESSION NOTICE (IMMOVABLE PROPERTY)**

Whereas, The undersigned being the authorized officer of the BANK OF BARODA under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (S4 of 2002) and in exercise of powers conferred under Section 13(2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 15/07/2019 calling upon the Borrower/Guarantors **Mr. Sanjaybhai Mangubhai Mangukiya (Borrower and Mortgagor) and Mrs. Nitaben Sanjaybhai Mangukiya (Co-Borrower)** to repay the amount mentioned in the notice being **Rs.17,36,829/-** (Rupees Seventeen Lacs Thirty Six Thousand Eight Hundred Twenty Nine Only) as on 20/04/2019 with further interest and expenses within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken **POSSESSION** of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **26th day of May, 2023**.

The borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda for an amount of **Rs.17,36,829/-** (Rupees Sixteen Lacs Ninety Eight Thousand Four Hundred Eighty Four Only) Plus uncharged interest thereon and other charges.

**Description of the Immovable Property**

All that piece and parcel of 501 admeasuring about 42.74 sq.mtrs built up as per sanctioned plan on 4th floor at place 5th floor of building no.F/1 of **Star Dharm Residency** together with undivided proportionate land underneath the same building constructed on the land bearing Revenue Survey No.61 of T.P Scheme No.45 (Navagam-Vav) (Revenue survey No.70 i.e. Block no. 82) of Village : Navagam, Taluka : Kamrej, Dist.Surat in the name of **Mr.Sanjaybhai Lalubhai Mangukiya and Mrs.Nita Sanjaybhai Mangukiya.**

Date : 26/05/2023 Authorised Officer, Bank of Baroda, Surat.

LINK PHARMA CHEM LIMITED					
Regd. Off. : 16, GIDC Estate, Nandesari - 391 340, Dist. Vadodara Ph. : 0265-2840281 CIN : L24230GJ1984PLC007540, email id : linkpharmacs@gmail.com, www.linkpharmachem.co.in					
EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2023					
(Rs. in Lacs except EPS)					
SR NO	Particulars	Quarter ended		Year ended	
		31-03-2023 (Audited)	31-12-2022 (Unaudited)	31-03-2022 (Audited)	31-03-2023 (Audited)
		31-03-2023 (Audited)	31-12-2022 (Unaudited)	31-03-2022 (Audited)	31-03-2023 (Audited)
1.	Total Income From Operations	929.14	936.38	1,128.95	3,875.78
2.	Net Profit For The Period (before Tax, Exceptional Items)	-23.41	29.94	32.59	88.63
3.	Net Profit For The Period Before Tax (after Exceptional Items)	-23.41	29.94	32.59	88.63
4.	Net Profit For The Period After Tax (after Exceptional Items)	-19.34	17.93	27.37	65.42
5.	Total Comprehensive Income for the Period [Comprising Profits for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-31.18	18.90	28.21	56.41
6.	Equity Share Capital	444.06	444.06	444.06	444.06
7.	Earnings Per Share (of Rs. 10/- Each) (For Continuing and Discontinued Operations)				
	1. Basic	Rs. (0.44)	Rs.0.40	Rs. 0.62	Rs. 1.47
	2. Diluted	Rs. (0.44)	Rs.0.40	Rs. 0.62	Rs. 1.47
NOTES : (I) The above is an extract of the detailed format of Audited Financial Results for the Quarter and Year ended March 31, 2023 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Year ended Financial Results are available on the websites of the Stock Exchange and the Company's website.					
For Link Pharma Chem Limited Sd/- Satish G. Thakur Chairman & Whole-Time Director (DIN : 00292129)					
DATE : 29-05-2023 Place : Vadodara					

TATA CAPITAL HOUSING FINANCE LIMITED				
Registered Address: 11th Floor, Tower A, Peninsula Business Park, Ganpatrao Kadam Marg, Lower Parel, Mumbai 400013. Branch Address : Office No 208 To 212   2nd Floor, Eco Futurz, Nr. Khatu Shyamji Temple, New City Light Road, Surat 395007.				
NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY				
(Under Rule 9(1) of the Security Interest (Enforcement) Rules 2002)				
E-Auction Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the below Borrower and/ Co-Borrower, or their legal heirs/representatives (Borrowers) in particular that the below described immovable property mortgaged to Tata Capital Housing Finance Ltd. (TCHFL), the Possession of which has been taken by the Authorised Officer of TCHFL, will be sold on <b>15-06-2023</b> on "As is where is" & "As is what is" and "Whatever there is" basis for recovery of outstanding dues from below mentioned Borrower and Co-Borrowers. The Reserve Price and the Earnest Money Deposit is mentioned below. Notice is hereby given that, in the absence of any postponement/ discontinuance of the sale, the said secured asset/ property shall be sold by E- Auction at 2.00 P.M. on the said <b>15-06-2023</b> . The sealed envelope containing Demand Draft of EMD for participating in E- Auction shall be submitted to the Authorised Officer of the TCHFL on or before <b>14-06-2023 till 5.00 PM</b> at Branch address TATA CAPITAL HOUSING FINANCE LIMITED, Office No 208 To 212   2nd Floor, Eco Futurz, Nr. Khatu Shyamji Temple, New City Light Road, Surat- 395007. The sale of the Secured Asset/ Immovable Property will be on "as is where condition is" as per brief particulars described herein below :				
Loan A/c No.	Name of Borrower(s)/ Co-borrower(s) Legal Heir(s)/ Legal Representative/Guarantor(s)	Amount as per Demand Notice	Reserve Price	Earnest Money
9888382	Mr. Lakshmana Ram Mrs. Vimla Laxmana Ram	Rs. 12,62,563/- (Rupees Twelve Lakh Sixty Two Thousand Five Hundred Sixty Three Only) 24-07-2021	Rs. 7,15,000/- (Rupees Seven Lakh Fifteen Thousand Only)	Rs. 71,500/- (Rupees Seventy One Thousand Five Hundred Only)
Description of the Immovable Property: All the rights, piece & parcel of Immovable property bearing Plot No. 80 Admeasuring 48.00 Sq. Yard, as per K.J.P. Block No. 196/80 admeasuring 40.15 Sq. Mtr., along with road and C.O.P. admeasuring 22.23 Sq. Mtr., along with undivided share proportionate share in the underneath land of the building and all internal and external rights thereto of the premises/campus known as "SHYAM LAKE CITY", constructed on non-agricultural land for residential use situated at Block No. 196 admeasuring 01-16-54 Sq. Mtr. and Block No. 220 admeasuring 01-89-08 Sq. Mtr. totalling Block No. 196 admeasuring 03-05-62 Sq. Mtr., situated at Moje Village: Velanji, Sub- Dist. & Taluka: Kamrej, District: Surat of Gujarat. Bounded - East :- Adj. Plot No. 107, West :- Adj. Society Internal Road, North :- Adj. Plot No. 79, South :- Adj. Plot No. 81.				
At the Auction, the public generally is invited to submit their bid(s) personally. The Borrower(s)/Co-Borrower (s) are hereby given last chance to pay the total dues with further interest within <b>15 days</b> from the date of publication of this notice, failing which the Immovable Property will be sold as per schedule. The E auction will be stopped if, amount due as aforesaid, with interest and costs (including the cost of the sale) are tendered to the Authorised Officer or proof is given to his satisfaction that the amount of such secured debt, interest and costs has been paid before the date of the auction.				
No officer or other person, having any duty to perform in connection with this sale shall, however, directly or indirectly bid for, acquire or attempt to acquire any interest in the Immovable Property sold.				
The sale shall be subject to the conditions prescribed in the Security Interest (Enforcement) Rules, 2002 and to the following further conditions:				
NOTE: The E-auction of the properties will take place through portal <a href="https://bankauctions.in/">https://bankauctions.in/</a> on <b>15-06-2023 between 2.00 PM to 3.00 PM with limited extension of 10 minutes each.</b>				
Terms and Condition: (1) The particulars specified in the Schedule herein below have been stated to the best of the information of the undersigned, but the undersigned shall not be answerable for any error, misstatement or omission in this proclamation. In the event of any dispute arising as to the amount bid, or as to the bidder, the Immovable Property shall at once again be put up to auction subject to the discretion of the Authorised Officer. (2) The Immovable Property shall not be sold below the Reserve Price. (3) Bid Increment Amount will be: Rs.10,000/- (Rupees Ten Thousand Only) (4) All the Bids submitted for the purchase of the property shall be accompanied by Earnest Money as mentioned above by way of a Demand Draft favoring the "TATA CAPITAL HOUSING FINANCE LTD." Payable at Branch address. The Demand Drafts will be returned to the unsuccessful bidders after auction. For payment of EMD through NEFT/RTGS/IMPS, kindly contact Authorised Officer. (5) The highest bidder shall be declared as successful bidder provided always that he/she is legally qualified to bid and provided further that the bid amount is not less than the reserve price. It shall be in the discretion of the Authorised Officer to decline acceptance of the highest bid when the price offered appears so clearly inadequate as to make it inadvisable to do so. (6) For reasons recorded, it shall be in the discretion of the Authorised Officer to adjourn/discontinue the sale. (7) Inspection of the Immovable Property can be done on <b>08-06-2023</b> between 11 AM to 5.00 PM with prior appointment. (8) The person declared as a successful bidder shall, immediately after such declaration, deposit twenty-five per cent of the amount of purchase money/bid which would include EMD amount to the Authorised Officer within 24hrs and in default of such deposit, the property shall forthwith be put to fresh auction/Sale by private treaty. (9) In case the initial deposit is made as above, the balance amount of the purchase money payable shall be paid by the purchaser to the Authorised Officer on or before the 15th day from the date of confirmation of the sale of the property, exclusive of such day, or if the 15th day be a Sunday or other holiday, then on the first office day after the 15th day. (10) In the event of default of any payment within the period mentioned above, the property shall be put to fresh auction/Sale by private treaty. The deposit including EMD shall stand forfeited by TATA CAPITAL HOUSING FINANCE LTD and the defaulting purchaser shall lose all claims to the property. (11) Details of any encumbrances, known to the TATA CAPITAL HOUSING FINANCE LTD, to which the property is liable: as per table above. Claims, if any, which have been put forward to the property and any other known particulars bearing on its nature and value: as per table above. The Intending Bidder is advised to make their own independent inquiries regarding encumbrances on the property including statutory liabilities areas of property tax, electricity etc. (12) For any other details or for procedure online training on e-auction the prospective bidders may contact the Service Provider, M/s. 4Closure, Block No.605 A, 6th Floor, Maitrivanam Commercial Complex, Ameerpet, Hyderabad 500038 through its coordinators Mr. U.Subbarao, Mob. No.814200061, subbarao@bankauctions.in or Manish Bansal, Email id Manish.Bansal@atacapital.com Authorised Officer Mobile No 8588983696. Please send your query on WhatsApp Number 999078669 (13) TDS of 1% will be applicable and payable by the highest bidder over the highest declared bid amount. The payment needs to be deposited by highest bidder in the PAN of the owner/ borrower(s) and the copy of the challan shall be submitted to our company. (14) Please refer to the below link provided in secured creditor's website <a href="https://bit.ly/3q3wNUb">https://bit.ly/3q3wNUb</a> for the above details. (15) Kindly also visit the link: <a href="https://www.tatacapital.com/property-disposal.html">https://www.tatacapital.com/property-disposal.html</a>				
Please Note - TCHFL has not engaged any broker/agent apart from the mentioned auctioning partner for sale/auction of this property. Interested parties should only contact the undersigned or the Authorised officer for all queries and enquiry in this matter.				
Place : Surat Sd/- (Authorised Officer) Date : 30-05-2023 Tata Capital Housing Finance Ltd.				

ESSAR SHIPPING LIMITED										
Regd. Office: EBTSL Premises, ER-2 Building (Admin Building) Salaya, 44 KM, P.O. Box No.7, Taluka Khambalia, Devbhumi Dwarka, Gujarat - 361305 Email: Esl.secretarial@essarshipping.co.in, Website: www.essar.com, CIN: L61200GJ2010PLC060285 Head Office: Essar House, 11, Keshavnagar Khadye Marg, Mahalaxmi, Mumbai - 400 034										
Statement of Standalone and Consolidated Audited Financial Results for the quarter and Year ended 31 March 2023										
(Rs in Crore)										
Sr. No.	Particulars	Standalone					Consolidated			
		Quarter ended		Year ended			Quarter ended		Year ended	
		31.03.2023 (Un-audited)	31.12.2022 (Un-audited)	31.03.2022 (Un-audited)	31.03.2022 (Audited)	31.03.2022 (Audited)	31.03.2023 (Un-audited)	31.03.2022 (Un-audited)	31.03.2022 (Audited)	31.03.2022 (Audited)
1	Total income from operations	2.70	15.59	74.24	38.86	302.09	28.61	63.43	122.91	165.94
2	Net Profit / (Loss) for the period / year (before tax, exceptional items and extraordinary items)	(4.26)	8.00	26.78	(72.53)	(24.57)	63.27	11.30	17.26	(35.23)
3	Net Profit / (Loss) for the period / year before tax (after exceptional items and/or extraordinary items)	416.31	1,326.21	236.35	1,666.25	(249.71)	377.53	1,323.29	231.99	1,625.10
4	Net Profit / (Loss) for the period/year after tax (after exceptional items and/or extraordinary items)	417.19	1,335.08	236.35	1,692.71	(249.97)	378.42	1,332.17	231.99	1,651.56
5	Total comprehensive Profit / (Loss) for the period	417.38	1,335.08	236.77	1,692.88	(249.75)	364.98	1,346.00	226.36	1,651.97
6	Paid-up equity share capital (face value of 10/- each)	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98
7	Reserves (Excluding Revaluation Reserve)	-	-	-	(1,810.45)	(3,503.32)	-	-	-	(2,949.06)
8	Securities Premium Account	3.36	3.36	3.36	3.36	3.36	60.95	66.46	61.14	60.95
9	Net Worth	(1,603.47)	(2,020.84)	(3,296.35)	(1,603.47)	(3,296.35)	2,742.08	(3,719.97)	(4,913.79)	2,742.08
10	Paid up Debt Capital / Outstanding Debt	1,935.88	2,225.51	2,511.54	1,935.88	2,511.54	2,703.92	3,369.35	4,105.67	2,703.92
11	Outstanding Redeemable Preference Shares	-	-	-	-	-	-	-	-	-
12	Debt equity ratio (times)	(1.21)	(1.10)	(0.76)	(1.21)	(0.76)	0.99	(0.91)	(0.84)	0.99
13	Earnings per share (of ₹10/- each) (EPS)									
	(a) Basic (in ₹)	*20.16	*64.5	*11.42	81.78	*(12.08)	*17.62	*65.03	*10.91	79.81
	(b) Diluted (in ₹)	*20.16	*64.5	*11.42	81.78	*(12.08)	*17.62	*65.03	*10.91	79.81
14	Capital Redemption Reserve	-	-	-	-	-	-	-	-	-
15	Debt redemption reserve	0.00	101.17	101.17	0.00	101.17	-	101.17	101.17	-
16	Debt service coverage ratio (times)	(0.03)	0.03	0.45	0.04	0.29	1.15	0.09	0.49	0.08
17	Interest service coverage ratio (times)	(2.06)	2.36	1.65	0.24	1.11	(1.45)	0.53	1.45	0.41
*Not annualised										
NOTE: The above is an extract of the detailed format of Standalone & Consolidated Financial Result for the quarter and year ended 31 March, 2023 filed with stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and consolidated audited Financial Results for the quarter and year ended 31 March, 2023, are available on the website of the Company, <a href="http://www.essar.com">www.essar.com</a> and website of the Exchange ( <a href="http://www.bseindia.com">www.bseindia.com</a> and <a href="http://www.nseindia.com">www.nseindia.com</a> )										
For Essar Shipping Limited Sd/- Rajesh Desai Director										
Place: Mumbai Date: 29 May 2023										

Rapicut Carbides Limited					
Regd. office : 119, GIDC Industrial Area, Ankleshwar - 393002 Gujarat Tele : 7573022016/7622002203 CIN : L28910GJ1977PLC002998 Email : investors@rapicutcarbides.com Website : www.rapicutcarbides.com					
EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2023					
(Rs in Lakhs)					
Particulars	Quarter ended			Year ended	
	31-03-2023 (Audited)	31-12-2022 (UnAudited)	31-03-2022 (Audited)	31-03-2023 (Audited)	31-03-2022 (Audited)
1. Total Income from Operations	1570.45	820.61	1244.31	3957.26	3613.64
2. Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(11.06)	(59.30)	30.30	(112.65)	(63.85)
3. Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(11.06)	(59.30)	30.30	(112.65)	(63.85)
4. Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(33.65)	(59.30)	(11.42)	(135.25)	(105.56)
5 Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(5.02)	(59.30)	1.58	(104.18)	(106.71)
6. Equity Share Capital	537.12	537.12	537.12	537.12	537.12
7. Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year				1604.72	1708.90
8. Earnings Per Share (of Rs. 10/- each) (for continuing & discontinued operations)					
	1. Basic:	(0.63)	(1.10)	(0.21)	(2.52)
	2. Diluted:	(0.63)	(1.10)	(0.21)	(2.52)
NOTES : 1) The above audited financial results have been prepared in accordance with the Indian Accounting Standards specified under Section 133 of the Companies Act, 2013. The above is an extract of the detailed format of audited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the yearly audited Financial Results are available on the below mentioned websites :- Company's Website : <a href="http://www.rapicutcarbides.com/finance.htm">http://www.rapicutcarbides.com/finance.htm</a> , BSE Limited : <a href="http://www.bseindia.com">www.bseindia.com</a>					
2) The above audited Financial Results have been reviewed and approved by the Board of Directors at their respective meeting held on 29th May, 2023.					
3) The financial results for the quarter ended 31st March, 2023 have been audited by the Statutory Auditors as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended.					
4) Figures for the quarters ended 31st March, 2023 and 31st March, 2022 as reported in these financial results are balancing figures between the audited figures in respect of the full financial year and published year to date reviewed figures up to third quarter of the relevant financial year.					
5) The Company has only one reportable primary business segment as per IndAS 108 i.e. Tungsten Carbide Products.					
6) Figures of corresponding previous year/period(s) have been regrouped/rearranged wherever necessary, to make them comparable.					
Place : Ankleshwar Date : 29-05-2023					
For and on behalf of the Board RAPICUT CARBIDES LIMITED Sd/- Abhishek V. Gami Managing Director (DIN: 07570948)					

